

(52/A-13)

Seat No.:

No. of Printed Pages: 03

SARDAR PATEL UNIVERSITY

S. Y. B. Sc. (Semester-III)

November 2019

Subject Code: US03ECHE05 (Basic Analytical Chemistry)

Industrial Chemistry & Industrial Chemistry Vocational

Date: 30<sup>th</sup> November 2019, Time: 02:00 to 04:00

Total Marks: 70

Saturday

Q.1 Answer the following MCQ's (All are compulsory)

(10)

1. The difference between experimental value and true value is called as....( સાચા મૂલ્ય અને પ્રાયોગિક મૂલ્ય વચ્ચેના તફાવત નું શું કહે છે?)  
a. Variance/ વેરીએન્સ      b. Precision/ પ્રીશ્યાદિ      c. Error/ ક્ષતિ      d. Accuracy/ ઓક્સાઈ
2. "y =ax + b" is the standard equation for....("y =ax + b" એ સમીકરણ કોણ લાગુ પડે છે?)  
a. Straight line/ સુરેખ આલેખ      b. Curve/ વણાંક આલેખ      c. Slope/ ઢાળ      d. Intercept/ આંતરછેદ
3. The degree of closeness between measured values is \_\_\_\_\_ (પ્રાયોગિક મૂલ્યો વચ્ચેની નિકટતાને \_\_\_\_\_ કહેવામાં આવે છે.)  
a. વેરીએન્સ Variance      b. પ્રીશ્યાદિ Precision      c. ક્ષતિ Error      d. ઓક્સાઈ Accuracy
4. HCl ની શાન્તતા શોધવા માટે ક્યાં અનુમાપન નો ઉપયોગ થાય છે? Which of the following titration is used for estimation of strength of HCl?  
a. તટસ્થીકરણ Neutralization      b. જટીલમિતીય Complexometric      c. અવક્ષેપણ Precipitation      d. રેડોક્સ Redox.
5. Which solution resists change in pH of solution? (pH બદલાવ નું અવરોધ કરતા દ્રાવણ ને \_\_\_\_\_ કહે છે.)  
a. બફર Buffer      b. સૂચક Indicator      c. એસીડ Acid      d. આપેલ એક પણ નહિ None of these.
6. Which of the following indicator is most widely used in complexometric titration? (જટીલમિતીય અનુમાપનમાં સૌથી વ્યાપક વપરાતું સૂચક?)  
a. EBT      b. ફીનોફ્ફેલેઇન Phenolphthalein      c. મીથાઇલ રેડ Methyl red  
d. આપેલ એક પણ નહિ none of these
7. The substance used for the detection of end point by colour change is \_\_\_\_\_ (રંગ પરિવર્તન દ્વારા અંત્યબિંદુ શોધવા માં વપરાતા પદાર્થને \_\_\_\_\_ કહેવામાં આવે છે)  
a. Buffer/ બફર      b. Indicator/ સૂચક      c. Reagent/ પ્રક્રિયક      d. None of these/ આપેલ એક પણ નહિ.
8. While preparing the solution of iodine, KI is added; which forms \_\_\_\_\_ complex (આયોડીનનું દ્રાવણ બનાવતી વખતે KI નાખવાથી \_\_\_\_\_ બને છે)  
a. I<sub>3</sub>      b. I<sub>3</sub><sup>-</sup>      c. I<sup>-</sup>      d. None of these
9. Which of the following method is used for the estimation of Cl- ion? (Cl- આયન ના આંકલન માટે વ્યાપક વપરાતી પદ્ધતિ કઈ છે?)  
a. મોહર પદ્ધતિ/Mohr's method      b. વોલહાર્ડ પદ્ધતિ/Volhard method  
c. ફજાન પદ્ધતિ/Fajans method      d. All of these/ આપેલ બધા.

①

C.P.T.-G.-  
.....

10. Which of the following is the reverse process of coagulation? (નીચેમાંથી.....એ કોએગુલેશનની (એકત્રીકરણ) વિપરીત પ્રક્રિયા છે.
- પેપ્ટાઇઝેશન/Peptisation
  - ભારમાંપન પદ્ધતિ/Gravimetry
  - પશ્ચ અવક્ષેપણ/Co-precipitation
  - None of these/આપેલ એક પણ નહિએ.

Q.2 Answer the following short questions (ANY TEN)/ નીચે આપેલ પ્રશ્નના ટ્રેકમાં જવાબ આપો. (કોઈ પણ દસ)

(20)

- What do you mean by relative average deviation? /સાપેક્ષ સરેરાસ વિચલન (રીલેટીવ એવરેજ ડિવિસન) વિષે સમજાવો.
- Differentiate between primary and secondary standards. /પ્રાથમિક અને દ્વિતીય રીતે પ્રમાણિત સંયોજનો વચે ના ભેદનો ઉલેખ કરો.
- What is the difference between gravimetric and volumetric analysis? /ભારમાંપન અને કદમાંપન પદ્ધતિ વચે નો અંતર શું છે?
- What do you mean by standardization? What is the purpose of it? /સ્ટેન્ડરડાઇઝેશન(માનકીકરણ) એ શું છે અને શા માટે કરવામાં આવે છે?
- Define the term Titrand and titrant. /ટાઇટ્રન્ડ અને ટાઇટ્રાન્ટ ની વ્યાખ્યા આપો.
- Why complexometric titration is generally carried out in presence of ammonia buffer? /જટીલમીતીય કદમાંપન પદ્ધતિ શા માટે ઓમોન્યા બફરની હાજરીમાં કરવામાં આવે છે?
- Describe the characteristics of primary standards. /પ્રાથમિક પ્રમાણિત પ્રક્રિયકોની વિશેષતાઓ જણાવો.
- Why disodium salt of EDTA is used during titration instead of pure EDTA. / EDTA અનુમાપન વખતે નું EDTAનું ડાઈ-સોલ્ડયમ ક્ષારનું દ્રાવણ શા માટે વાપરવામાં આવે છે અને શુષ્ઠ EDTAનું દ્રાવણ શા માટે નથી વપરાતું?
- Give examples of primary standards used in different types of titrations. /જુદા-જુદા અનુમાપનમાં વપરાતા પ્રાથમિક પ્રમાણિત પ્રક્રિયકો ના ઉદાહરણ આપો.
- What is the purpose of digestion steps in gravimetry? /ભારમાંપક પદ્ધતિ માં અવક્ષેપ સ્કેન પ્રક્રિયા શા માટે કરવામાં આવે છે?
- What do you mean by coagulation and peptization? /કોએગુલેશન અને પેપ્ટાઇઝેશન શું છે?
- What do you mean by post-precipitation? /પશ્ચ અવક્ષેપન એટલે શું?

(2)

Q.3 Describe the different types of errors. / ક્ષતિઓ ના પ્રકારો વર્ણાવો. (10)

OR

Q.3 Write a note of Q-test, T-test and F-test. / Q-પરીક્ષણ, T- પરીક્ષણ and F- પરીક્ષણ વિશે દુંક નોંધ લખો. (10)

Q.4 Discuss the neutralization curve for strong acid vs. strong base titration and show how pH changes during the titration. / સાન્ડ એસીડ અને સાન્ડ બેઝ વચ્ચે તટસ્થીકરણ સમજાવી તેનો આલેખ સમજાવો અને આ અનુમાપન માં થતા pH ફેરફાર વિશે જણાવો. (10)

OR

Q.4 Derive the equation for colour change interval of an indicator. / સૂચકની હાજરીમાં થતા રંગ પરિવર્તન માટે નું સમીકરણ તાંરવો. (10)

Q.5 List out different types of titration. Explain any two in brief. / કદમાંપનના અલગ પ્રકારોનું વર્ણન કરો અને કોઈ પણ બે કદમાંપન પદ્ધતિનું દુંકમાં વર્ણન કરો. (10)

OR

Q.5 Discuss on titration mixture with respect to selectivity, masking, demasking agents. / અનુમાપન મિશ્રણ નું શીલેક્ટીવિટી, માંસ્કિંગ અને ડી-માંસ્કિંગ ના સંદર્ભે વર્ણન કરો. (10)

Q.6 Discuss Volhard's and Fajans method for precipitation titration. / વોલહાર્ડ અને ફજાન અવક્ષેપન કદમાપન પદ્ધતિ ઉપર દુંક નોંધ લખો. (10)

OR

Q.6 Discuss conditions of precipitation. / અવક્ષેપન ની સ્થિતિનું વર્ણન કરો. (10)

— ✗ —

(3)

